

નિયમ સંગ્રહ-૧૭

૧૭.૬ જાહેરતંત્રે ઉઘરાવવા અંગે

(મ્યુનિસિપલ કોર્પોરેશન, વ્યવસાય વેરો, મનોરંજન વેરો વિગેરે)

વેરા બાબતે કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી.

- વેરાનુ નામ.
- વેરો લેવાનો હેતુ
- કર નિર્ધારણ માટેની કાર્યવાહી અને માપદંડ.
- મોટા કસુરદારોની યાદી
૧૭.૬ વીજળી/પાણી હંગામી અને કાયમી જોડાણો આપવા અને કાપવા અંગે
(આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન/નગરપાલિકા/યુપીસીએલને લાગુ પડશે)
(પીવાના પાણીના કનેક્શન પાણી પુરવઠા અને ગટ્ઠર વ્યવસ્થા બોર્ડ દ્વારા આપવામા આવે છે.)
- જોડાણ માટેની પાત્રતા
ગ્રામ પંચાયત/નગરપાલિકા/મહાનગરપાલિકા/જાહેર તેમજ ખાનગી સંસ્થાઓ
- પુર્વ જરૂરિયાતો (જો હોય તો)
ના
- અરજી માટેની સંપર્ક માહિતી
ક્ષેત્રીય કક્ષાએ જે તે વિભાગીય કચેરીઓ
- અરજી ફી (લાગુ પડતુ હોય ત્યાં)
નથી
- અન્ય ફી શુલ્ક (લાગુ પડતુ હોય ત્યાં)
નથી.
- અરજીનો નમુનો (જો અરજી સાદા કાગળ ઉપર કરવામા આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો)
સાદા કાગળ ઉપર.
- બિડાણો/દસ્તાવેજોની યાદી
સહમતી પત્રક.
- બિડાણ/દસ્તાવેજોનો નમુનો
નમુનો નથી.
- અરજી કરવાની પધ્ધતિ
વિભાગીય કચેરીને અરજી કરવાની રહે.
- અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા.
- બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવે છે.
- બિલમાં વાપરેલ શબ્દ પ્રયોગનુ ટુંકું વિવરણ
પાણી વેરો
- બિલ અથવા સેવાની બાબતમાં મુશ્કેલી હોય તો સંપર્ક માહિતી
- ટેરીફ અને અન્ય ખર્ચ

અ.નં.	સંસ્થા	શુલ્ક
૧	ગ્રામ પંચાયત	જુથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લીધેલ

		ગામો માટે રૂ. ૨.૦૦ પ્રતિ એક હજાર લીટર.
૨	નગરપાલિકા/નગરપંચાયત	રૂ. ૪.૦૦ પ્રતિ એક હજાર લીટર
૩	મહનગરપાલિકા	રૂ. ૬.૦૦ પ્રતિ એક હજાર લીટર
૪	ખાનગી વ્યાવસયિક	રૂ. ૧૦.૦૦ પ્રતિ એક હજાર લીટર, ૩ માસના પાણી વેરા અગાઉ ચુકવવાનો રહે.
૫	ઉદ્યોગ માટેનું જોડાણ	રૂ. ૩૧.૯૩ પ્રતિ એક હજાર લીટર, ૩ માસના પાણી વેરા અગાઉ ચુકવવાનો રહે.
	નોંધ:	જોડાણ માટેની પાઇપલાઇન, મીટર વાલ્વ તથા મરામત અને નિભાવણીનો સમગ્ર ખર્ચ જે તે સંસ્થાએ ભોગવવાનો રહે છે.

૧૭.૮ જાહેર તંત્ર (ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ) દ્વારા પુરી પાડવામા આવનાર અન્ય સેવાઓની વિગત નીચે મુજબ છે.

(૧) બાંધકામ

પીવાના પાણીની યોજના માટેના સમગ્ર કામોની બાંધકામની કામગીરી કરવી. તાંત્રિક સક્ષમતાની ચકાસણી કરવી. અમલીકરણ કરવું. અને યોજના ચાલુ કર્યા બાદ જે તે સ્થાનિક સંસ્થાને મરામત અને નિભાવણી માટે સોંપવી. આ માટે સરકારશ્રીના નિયમોનુસારનું શુલ્ક બોર્ડ દ્વારા વસુલ કરવામા આવે છે.

(૨) ડીઝાઇન

સ્થાનિક સંસ્થા દ્વારા પાણી પુરવઠા યોજના માટે માંગણી/રજુઆત આવ્યા બાદ જે તે વિસ્તારની સ્થળ મુલાકાત લઈ પીવાના પાણીના યોજનાના ઘટકોની તાંત્રિક ડીઝાઇન કરવી. અને સમગ્ર યોજના તૈયાર કરવાની કામગીરી કરવી. આ માટે સરકારશ્રીના નિયમોનુસારનું શુલ્ક બોર્ડ દ્વારા વસુલ કરવામા આવે છે.

(૩) જાહેર મેળાવડા અને જાહેર સંભારંભોમાં પીવાના પાણીની વ્યવસ્થા

રાજ્ય સરકારશ્રીના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની સુચના મળ્યાથી જાહેર મેળાવડા/સમારંભોમાં પીવાના પાણીની સગવડ કરવી.

(૪) સ્થાનિક સંસ્થાઓની યોજના

સ્થાનિક સંસ્થાઓની પીવાના પાણીની યોજનાઓમાં નિયમ મુજબ તાંત્રિક ચકાસણી, સુપરવીઝન ચાર્જીસ વગેરે લઈ પીવાના પાણીની યોજનાની કમગીરી કરવી.